

The Power of Distribution

##AS FINANCIAL SERVICES LIMITED

MFSL/SEC/EQ/2020/66

13th November, 2020

To,

The Manager,

BSE Limited

Phiroze Jeejeebhoy Towers

Dalal Street

Mumbai - 400001

To,

General Manager

National Stock Exchange of India Limited

Exchange Plaza

Plot No. C/1, G Block

Bandra-Kurla Complex

Bandra (East)

Mumbai - 400051

Scrip Code: 540749, 947381

Trading Symbol: MASFIN

Dear Sir,

Sub.: Newspaper Advertisement of unaudited financial results for the second quarter & half year ended on 30th September, 2020.

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the company has given Newspaper Advertisement in One (1) English - FREE PRESS GUJARAT and One (1) Regional Language Newspaper - Gujarati - LOKMITRA for unaudited standalone and consolidated financial results for the second quarter & half year ended on 30th September, 2020.

Kindly take the same on your record.

Thanking you, Yours faithfully,

FOR, 無為家 FINANCIAL SERVICES LIMITED

RIDDHI BHAVESHBHAI BHAYANI (COMPANY SECRETARY & COMPLIANCE OFFICER) MEMBERSHIP NO.: A41206

Encl.: As above



Regd. Office:

6, Ground Floor, Narayan Chambers,

B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009. www.mas.co.in

CIN: L65910GJ1995PLC026064

\$\bigs\ + 91(0) 079 4110 6500 / 079 3001 6500

= + 91(O) 079 4110 6597,+ 91 (O) 079 4110 6561

mfsl@mas.co.in

Friday, November 13, 2020



Gurjars in Rajasthan called off agitation over reservation after 'agreement' with CM | Southall Punjab-origin man sentenced for wrong visa advice

Jaipur, Gurjar community their agitation over morning after signing an in Rajasthan has called off reservation on Thursday agreement with chief minister

NAGPUR - SEONI EXPRESS WAY LIMITED

CIN: U45203GJ2007PLC049963

Regd office : "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad - 380006 Tel: 9179 26463384. F: 9179 26400210 E: investor@sadbhavinfra.co.in, Web: www.sadbhavinfra.co.in

Extract of Unaudited Financial Results for the half year ended 30th September, 202

Sr. No.	Particulars	Half year ended	Half year ended
		30/09/2020 (Unaudited)	30/09/2019 (Unaudited)
1	Total Income from operations (net)	238.97	188.88
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(403.81)	(19.00)
3	Net Profit/(Loss) for the period (before Tax and after Exceptional and/or Extraordinary items)	(403.81)	(19.00)
4	Net Profit for the period after tax & after Exceptional and/or Extraordinary items	(404.07)	(19.00)
5	Total comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(404.07)	(19.00)
6	Paid up Equity Share Capital (Face value of Rs. 10 each)	4,800.00	4,800.00
7	Reserves (Excluding Revaluation Reserve)	(8,591.45)	(8,582.74)
8	Net Worth	(2,463.55)	(1,271.85)
9	Paid up Debt Capital / Outstanding Debt	16,553.30	15,265.00
10	Outstanding Redeemable Preference Shares	-	-
11	Debt Equity Ratio	3.45	2.55
12	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)		
	Basic and diluted	(0.84)	(0.04)
13	Capital Redemption Reserve	-	-
14	Debenture Redemption Reserve	1,327.90	1,327.90
15	Debt Service Coverage Ratio	2.06	1.41
16	Interest Service Coverage Ratio	1.42	2.01

The above is an extract of the detailed format of half yearly Financial Results filled with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the half yearly Financial Results is available on the websites of the Stock Exchanges, www.bseindia.com, and on the group Company website www.indinfravit.com.

For Nagpur-Seoni Express Way Ltd.

Place : Ahmedabad Date: November 04, 2020 Director (DIN: 07130355)

SANRHEA TECHNICAL TEXTILES LIMITED

Corporate Office & Works: Dr. Ambedkar Road, Kalol (N.G.) 382721. Phone: (02764) 225204, 227831 Fax: (02764) 227696, Regd. Office: Parshwanath Chambers, 2nd Floor, Nr. New RBI, Income Tax,

Ahmedabad - 380 014. **Email :** Sanrhea@gmail.com Tel. Fax: (079) 27545646 Web.: www.sanrhea.com

CIN: L17110GJ1983PLC006309

				(₹ In Lakhs
Sr. No.	Particulars	3 months ended on 30/09/2020	3 months ended	Year ended or 30/09/2020
		Unaudited	Unaudited	Unaudited
1	Total Income from operations	986.05	881.07	1413.82
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	40.82	3.25	(37.03)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	40.82	3.25	(37.03)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	48.38	0.09	(21.92)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	45.87	0.73	(26.94)
6	Equity Share Capital	379.00	379.00	379.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
-	(a) Basic	1.28	0.00	(0.58)
	(b) Diluted	1.28	0.00	(0.58)

Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the narterly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on Company's webs

The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) ting policies shall be disclosed by means of a footnote

2816.64

131.13

2456.03

Reserved for the year ended March 31, 2020 was standalone Rs. 4429.06 lakhs and consolidated Rs. 4426.87 lakhs

PLACE : AHMEDABAD

Total Income from operations

Net Profit for the period (before tax, exceptional and /or extraordinary items) 28.25

Net Profit for the period before tax (after exceptional and /or extraordinary

items)
Net Profit for the period after tax (after exceptional and /or extraordinary

Paid-up Equity Share Capital (face value of Rs.10/- each) Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year Earnings Per Share (face value of Rs. 10/- each) (for continuin

FOR, SANRHEA TECHNICAL TEXTILES LIMITED

TUSHAR PATEL MANAGING DIRECTOR

人 zota ZOTA HEALTH CARE LIMITED CIN: L24231G2000PLC038352 Registered office: Zota House, 2/896, Hira Modi Street, Sagrampura, Surat-395002, Gujara Email: Inifo@zotahealthcare.com Website:www.zotahealthcare.com P h: +91-261-2331601 EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2020

4571.60

146.40

146.40

2456.03

28.22

131.10

2456.03

91.77

194.65

2456.03

146.36

146.36

2456.03

91.60

194.48

2456.03

Ashok Gehlot. After an 11-day

long stalemate, the community leader Kirori Singh Bainsla met chief minister Ashok Gehlot on November 11 demanding reservation in jobs and education. They have signed an agreement with the

"We came to an agreement with the government last night, the community agrees with the settlement. We are vacating tracks, reinstalled all clips (on railway track) that were taken out. Gangman is checking the line, train service will resume soon. Agitation called off," said Gurjar leader Vijay Bainsla. Gurjar agitators were seen repairing fishplates, that they had damaged, on a railway track in Bharatpur where they were protesting with their demand for reservation. Rajasthan government on October 26, 2018, passed a bill that increased the Other Backward Classes (OBC) quota from 21 percent to 26 percent. In December 2018, the Rajasthan government also approved one percent reservation for Gujjars and four other backward castes (OBCs). These communities are getting one percent separate reservation under the legal limit of 50 percent reservation meant for the most-backward category in addition to OBC

sked to clarify stand on Kashmir, J&K **High Court Bar Association** cancels election

Chandigarh, The Jammu and Kashmir High Court Bar Association has cancelled its elections and formed an ad hoc body to run its affairs after the government barred it from going ahead with the polls The Srinagar district administration on Monday ordered that no elections would be allowed till the Bar clarified its stand on whether it considers Kashmir a dispute or an integral part of India and also provided details of its registration. After a meeting on Wednesday, the Bar formed a 21-member ad hoc committee with senior member Nazir Ahmad Ronga as its chairman and put the poll process on hold. The committee comprised the candidates, former elected members and the election body. "It is hereby notified that post constitution of the ad hoc committee, the notification for conduct of elections stands recalled," the Bar said in a statement signed by its election commission secretary Mudasir Gulzar Vakil. The body, which started its election process in September after the release of its incumbent president Mian Abdul Qayoom, who was detained following the revocation

Balvinder Singh Madan, who pleaded guilty to providing unregulated immigration advice to people in offices in north-west London between October 2017 and April 2018, has been given community sentence of 80 hours of unpaid work and fined. Madan, 40, was sentenced at the Westminster Magistrates Court after admitting to one count of the criminal offence at an earlier court appearance officials said on Thursday. Apart from the community sentence and prosecution costs, he must pay £600 (Rs 59.007) compensation to the victim and a £85 (Rs 8,365) victim surcharge. The Office of the Immigration Services Commissioner (OISC) was contacted by the victim who made a complaint after she paid £600 for inadequate advice and negligent service that led to her leave to remain application being rejected by the Home Office. Investigations showed that

Madan did not possess the

Chandigarh, Southall-based relevant authorisation, training or qualifications. Immigration of the conviction, "Mr Madan her trust and future in him.

RAJKOT INV			ED						
(CIN:L6	5910GJ1982P	LC005301)							
(Regd. Office: B-16, Second Floor,	, kalyan building l	kuvadva road , Rajko	t-360001 Gujrat)						
E-mail id:Info@ritl.co.in website:www.ritl.co.in									
			(Rs. In Lakhs) Excep	ot EPS and Face Value of Share					
Extract of Unaudited Financial Result									
		r Ended on	Half Year ended on	Year Ended on					
Particulars	30-09-2020	30-09-2019	30-09-2020	31-03-2020					
	(Un-audited)	(Un-audited)	(Unaudited)	(Audited)					
Total income from operations	8.18	9.19	17.30	37.77					
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary									
items)	(2.26)	1.69	4.50	(3.33)					
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or									
Extraordinary items)	(2.68)	1.69	(0.44)	(3.33)					
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary									
items)	(2.68)	1.69	(0.44)	(5.73)					
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the									
period (after tax) and Other Comprehensive Income (after tax)]	(2.68)	1.69	(0.44)	(5.73)					
Equity Share Capital	100.00	100.00	100.00	100.00					
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year									
Earnings Per Share (of Rs. 10 /- each)(for continuing and discontinued operations)									
Basic :	(0.27)	0.17	(0.04)	(0.57)					
Diluted:	(0.27)	0.17	(0.04)	(0.57)					

s:"1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Excha lation 33 of the SEBI (Listing Obligations and DisclosureRequirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the the website of the Company (www.ritt.co.in) and on the website of BSE Ltd (www.bseindia.com)

2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in ecounting policies shall be disclosed by means of a footnote. "3. Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable."

For, RAJKOT INVESTMENTTRUST LIMITED

(Director) (DIN:02921783)

REAL STRIPS LIMITED

Registered Office: Survey No.245-246, Village Sari, Ahmedabad-Bavla Highway, Taluka Sanand, Dist.: Ahmedabad - 382220, Gujarat. CIN.: L27100GJ1990PLC014383 Telephone: +91 92280 02011, +91 92280 02012 Email: ramcharan@realstrips.com Website: www.realstri Com. No. Bombay Stock Exchange :- 513558

Statement of Unaudited Financial Results for the Quarter and Half Year Ended 30th September 2020

				(R	s In Lacs exce	pt as stated)
	C	Quarter Ended		Half Yea	Year Ended	
PARTICULARS	30.09.2020	30.06.2020	30.09.2019	30.09.2020	30.09.2019	31.03.2020
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total Income from operations	3,226.53	1,227.67	2,615.97	4,454.20	5,308.48	10,248.67
Net Profit / (Loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	362.03	(279.56)	293.37	82.47	608.47	578.74
Net Profit / (Loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	362.03	(279.56)	293.37	82.47	608.47	578.74
Net Profit / (Loss) for the period (after tax, exceptional and / or extraordinary items)	362.03	(279.56)	293.37	82.47	608.47	465.15
Total Comprehensive Income for the period (comprising profit for the period after tax and other comprehensive income after tax)	-	-	-	-	-	(5.75)
Equity Share Capital (Face value of Rs.10/- each)	597.50	597.50	597.50	597.50	597.50	597.50
Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	=	-	=	=	П	(1,681.92)
Earnings Per Share (For Continuing and Discontinued operations) (Amount in Rs.)						
- Basic & Diluted (Not annualised)	6.05	(4.67)	4.91	1.38	10.18	7.78

Notes:

1 The above unaudited financial results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on November 12, 2020. The aforesaid unaudited financial results have been subjected to limited review by the auditor of the

With the easing of lockdown in various states of India and the increasing economic activities in phased manner, the Company has continued its With the easing of lockdown in various states of India and the increasing economic activities in phased manner, the Company has continued its assessment of likely adverse impact on economic environment in general and financial risks on account of COVID-19. The Company has considered the possible effects that may result from the pandemic relating to COVID-19 on the carrying amounts of property, plant and equipment, investments, inventories, receivables and other current assets. In developing analysis on the assumptions used and based on current estimates the assumptions relating to the possible future uncertainties in the global economic conditions including conditions in India because of this pandemic, the Company, as at the date of approval of these financial results has used internal and external sources on the expected future performance of the Company, Based on current estimates expects the carrying amount of this assets are fully recoverable. The Company continues to regularly review and moderate their significant estimates, including regular discussions with its key customers and vendors. The Company believes that impact of COVID-19 on the Company's financial results is not material.

During the period, the part of the land of the company have been acquired by the Government and of which consideration of Rs 162.53 lacs has been received and gain thereon of Rs 162.38 lacs has been considered as "Other Income".

Figures of the previous periods have been regrouped and reclassified to confirm to the classification of the current period, wherever necessary

Place: Sari-Village Date: 12th November, 2020

Place : Ahmedabad Date : 11 November 2020

For Real Strips Limited, Prakashraj S. Jain Joint Managing Director DIN - 00435076

MAS FINANCIAL SERVICES LTD.

Regd. Office: 6,Ground Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009.

Phone No.: +91 79 41106500, Fax No.: +91 79 41106597, E-mail: riddhi_bhayani@mas.co.in, Website: www.mas.co.in

CIN: L65910GJ1995PLC026064

Extract of standalone and consolidated unaudited financial results for the quarter and half year ended 30 September 2020

			Standalone		Consolidated			
Sr. No.	Particulars	Quarter ended 30 September 2020 (Unaudited)	Half year ended 30 September, 2020 (Unaudited)	Quarter ended 30 September, 2019 (Unaudited)	Quarter ended30 September 2020 (Unaudited)	Half year ended30 September, 2020(Unaudited)	Quarter ende 30 September 2019 (Unaudited)	
1	Total income from operations	15,262.17	31,261.14	16,737.41	16,189.91	33,063.90	17,705.7	
2	Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	4,563.10	9,455.15	4,999.81	4,712.13	9,744.15	5,140.4	
3	Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	4,563.10	9,455.15	4,999.81	4,712.13	9,744.15	5,140.4	
4	Net profit / (loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	3,420.40	7,079.63	4,019.82	3,532.77	7,292.40	4,127.3	
5	Total comprehensive income for the period [comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	2,787.93	6,959.00	4,311.21	2,914.60	7,164.48	4,417.5	
6	Paid up equity share capital	5,466.20	5,466.20	5,466.20	5,466.20	5,466.20	5,466.2	
7(i)	Earning per share(of ₹ 10/- each) (for continuing and discontinued operations) - ((including exceptional item) (not annualised for quarter)							
	1. Basic (₹)	6.26	12.95	7.35	6.38	13.18	7.4	
	2. Diluted (₹)	6.26	12.95	7.35	6.38	13.18	7.4	
7(ii)	Earning per share(of ₹ 10/- each) (for continuing and discontinued operations) - ((excluding exceptional item) (not annualised for quarter))							
	1. Basic (₹)	6.26	12.95	7.35	6.38	13.18	7.4	
	2. Diluted (₹)	6.26	12.95	7.35	6.38	13.18	7.4	

been reviewed by the Audit Committee in their Meeting held on 10 November 2020 and the same was approved by the Board of Directors in their meeting held on 11 November 2020, subjected to a limited review by the Statutory Auditors and filed with the Stock Exchanges under Regulation 33 and Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Regulrements) Regulations, 2015. The full format of the quarterly financia results are available on the websites of the Stock Exchanges at www.bseindia.com, www.nseindia.com, and on the website of the Company at

www.mas.co.in.
The unaudited standalone and consolidated financial results of the Company have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Indian Accounting Standard (referred to as 'Ind AS') - 34, Interim Financial Reporting prescribed under Section 133 of the Companies Act, 2013 (the 'Act') read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and in compliance with Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the 'SEBI Listing Regulations'). Any application guidance/ clarifications/ directions issued by

Kamlesh C. Gandh (Chairman & Managing Director) (DIN - 00044852)

Reserve Bank of India ('RBI') or other regulators are implemented as and when they are issued/applicable

For and on behalf of the Board of Directors of

The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Director at its meeting held on November 11,, 2020.

The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditor of the Company Date: 12.11.2020

(Managing Director DIN: 0762521

The above is an extract of the detailed format of Quarterly and Half yearly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Annual Financial Results are available on the websites of the National Stock Exchange of India at www.nseindia.com and on the website of the Company at the www.zoshandaeltbcare.com.

The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors with the content below of National States.

Moxesh Zo

SUPERTEX INDUSTRIES LIMITED

CIN: L99999DN1986PLC000046
Regd.Off.: Plot No.45, Phase II Piperia Industrial Estate, Silvassa (D&NH.)

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30™ SEPTEMBER, 2020

30-Sep-20

(64)

(64)

(65)

(66)

1134

1620

દમણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકાના ૧૫ વોર્ડમાંથી ૧૧ છે. ભાજપના ઉમેદવાર વિજેતા બનતા દમણ ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. ૮ નવેમ્બરના નગરપાલિકામાં યોજાઈ હતી. જેમાં નગરપાલિકાની

Total income from operations (net)

[after Exceptional items]
Net Profit / (Loss) for the period after Tax
(after Exceptional items)
Total Comprehensive Income for the
period [Comprising Profit/(Loss) for the
period (after tax) and
Other Comprehensive Income (after tax)]

omer comprenensive income (and Paid-up Equity Share Capital Face Value of Rs. 10/- each) Reserves (excluding Revaluation Res shown in the Balance Sheet of previou

Note: The above is an extract of the detailed format of Qua

nd also on the website of the Company at www.supertex.ii

with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and

Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financia Results are available on the stock exchange website namely BSE Ltd at www.bseindia.co

HAS

The Power of Distributio

માસ ફાયનાન્સીયલ સર્વિસીસ લિમિટેડ

સીન નં. :165910G11995PLC026064 ૨જીસ્ટર્ડ ઓફીસ ઃ ૧, ગ્રાઉન્ડ ક્લોર, નારાયથા ચેમ્બર્સ, પહોટેલ પાદ આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯ કોન : + ૯૧ ૭૯ ૪૧૧૦ ૧૬૨ ઈમેલ: riddhi_bhayani@mas.co.in વેબસાઇટ: www.mas.co

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૨૫મી વાર્ષિક સામાન્ય સભ ("એજીએમ") ૯મી ડિસેમ્બર, ૨૦૨૦, બુધવાર સવારે ૧૧.૩૦ ક્લાકના રોજ વિડિઓ કોન્ફ્રેન્સિંગ("વીસી")/અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો("ઓએવીએમ") દ્વારા નોટિસમાં ભાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે , જે એજીએમ બોલાવવા માટે પ્રસારીત કરાઈ રહી છે.

કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકાર, કોર્પોરેટ એફેર મંત્રાલય દ્વારા

જારી કરાયેલ સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦ સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને સામાન્ય પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ તારીખ

પમી મે, ૨૦૨૦ અને સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇંડિયાએ તેના પરિપત્ર નં. SEBI/

HO/CFD/CMD1/CIR/P/૨૦૨૦/૭૯ તારીખ ૧૨ મે, ૨૦૨૦ ("જણાવેલ સેબી

પરિપત્ર") અંતર્ગત એક જ સ્થળે સભ્યોની શારીરિક હાજરી વગર વીસી)ઓએવીએમ દ્વારા એજીએમ યોજવાની પરવાનગી આપી છે . આ પરિપત્રો અને કંપની કાયદા ૨૦૧૩ની

સંબંધિત જોગવાઇઓ અને સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેંટ)

નિયમનો, ૨૦૧૫ના અનુપાલન હેઠળ કંપનીના સભ્યોની એજીએમ વીસી/ઓએવીએમ દ્વારા

સદરહું પરિપત્રો અંતર્ગત એજીએમ નોટિસ તેમજ વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપની અથવ

ડિપોઝીટરીઓ પાસે જે સભ્યોના ઈ-મેઇલ એડ્રેસ રજીસ્ટર્ડ છે તેમને ફક્ત ઇલેક્ટ્રોનિક રીતે

મોકલવામાં આવી રહ્યાં છે, સભ્યોએ નોંધ લેવી કે એજીએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ

૨૦૧૯-૨૦ કંપનીની વેબસાઇટ.www.mas.co.in સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઇટ અનુક્રમે

_www.bseindia.com અને _www.nseindia.com પર ઉપલબ્ધ રહેશે અને

એજીએમની નોટીસ સીડીએસએલની ("રીમોટ ઈ- વોટીંગ સવલત પુરી પાડનાર

એજેન્સી")વેબસાઇટ એટલે` <u>www.evotingindia.com</u> પર પણ ઉપલબ્ધ રહેશે

સભ્યો ફક્ત વીસી/ઓએવીએમ દ્વારા એજીએમ માં હાજર રહી શકે છે અથવા ભાગ લઈ શકે

છે. એજીએમ માં જોડવવાની સુચનાઓ એજીએમની નોટીસમાં આપેલ છે. વીસી/ઓએવીએમ

. દ્વારા સભામાં હાજર રહનાર સભ્યો ને કંપની કાયદા ૨૦૧૩ની કલમ ૧૦૩ મુજબ કોરમની

કંપની તેના સભ્યોને એજીએમની નોટીસમાં જણાવેલ તમામ ઠરાવો પર તેમના મતો આપવ

માટે રીમોટ ઈ- વોટીંગ સવલત (''રીમોટ ઈ- વોટીંગ'') પુરી પાડી રહી છે. આ ઉપરાંત કંપની એજીએમ દરમિયાન ઈ- વોટીંગ (''ઈ- વોટીંગ'') દ્વારા મતદાનની સવલત આપી રહી છે.

સભ્યોએ કંપની /ડિપોઝીટરી પાસે તેમના ઈમેઇલ એડ્રેસ રજીસ્ટર્ડ કરાવ્યા નથી તો તેમને વાર્ષિક

એ) ફીઝિકલ સ્વરૂપે શેરો ધરાવતા સભ્યો માટે riddhi bhavani@mas.co.inu ઈમેઇલ કરીને આવશ્યક વિગતો જેવીકે ફોલિયો નં.શેર હોલ્ડરનું નામ વગેરે જણાવવા વિનંતી

બી) ડિમીટ સ્વરૂપે શેરો ધરાવતા સભ્યો માટે - તેમના લાગતા વળગતા ડિપોઝીટરી

પાર્ચટીશીપન્ટનો સંપર્ક કરીને અથવા riddhi bhavani@mas.co.in પર ઈમેઇલ

કંપનીની ૨૫મી એજીએમની નોટીસ રવાનગીની કટ- ઓફના રોજ શેરો ધરાવતા શેર

હોલ્ડરોને તેમના રજીસ્ટર્ડ ઈમેઇલ એડ્રેસ પર નિશ્ચિત સમયે લાગુ કાયદાઓ મુજબ મોકલવામાં

તેમને રીમોટ ઈ વોટીંગના સંબંધમાં કોઈ પ્રશ્નો હોય તો. તમે હોલ્પ સેક્શન હેઠળ

www.evotingindia.com પર ઉપલબ્ધ વારવાર પુછાતા પ્રશ્ને ("એકએક્યએસ") અને ઈ-વોટીંગ મેન્યઅલ જોઈ શકો છો. અથવ helpdesk.evoting@cdslindia.com પર ઇમેઇલ કરી શકો છો. અથવા

માસ ફાઇનાન્સીયલ સર્વીસીસ લિમિટેડ

કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફીસર

રિધ્ધિ ભાયાણી

મેમ્બ.નં: એ૪૧૨૦૬.

રીમોટ ઈ- વોટીંગ/ઈ- વોટીંગની વિગતવાર પ્રક્રિયા એજીએમની નોટીસમાં આપેલ છે.

ગણતરી કરવા માટે ધ્યાન માં લેવામાં આવશે.

માટે નીચેની સચનાઓ અનસરવા વિનંતી છે.

આવશે.

તારીખ : ૧૧ નવેમ્બર, ૨૦૨૦

કરીને તેમના ઈમેઇલ આઈડી રજીસ્ટર્ડ કરાવવા વિનંતી છે.

કંપનીની ૨૫મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

Earnings Per Share (of Face Value of Rs. 10/- each)

Place : Mumbai Date : 11th November, 2020

Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)

Net Profit / (Loss) for the period before Tax
(after Exceptional items)

સીટ પર કબ્જો જમાવતા દમણ નગરપાલિકા ભાજપના ફાળે ગઈ વોર્ડ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિજેતા ઉમેદવારોએ ભાજપ કાર્યાલય ખાતે દમણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકરોએ ફટાકડા ફોડી ફટાકડા ફોડી વિજયની ઉજવણી વિજયોત્સવ મનાવ્યો હતો.દમણ વિજેતા રોજ દમણમાં નગરપાલિકાના ઉમેદવારોની યાદી પર નજર કરીએ મતદાન બાદ બુધવારે મત ગણતરી તો કુલ ૧૫ વોર્ડમાંથી વોર્ડ નંબર ૧, ૧૨ અને ૧૫ મહિલા સીટ ૧૫ સીટમાંથી ૩ સીટ પર ભાજપ ભાજપ તરફી બિનહરીફ બની હતી. બિનહરીફ જાહેર થયા બાદ ૧૨ જે બાદ વોર્ડ નંબર ૨માં અપક્ષ વોર્ડ માટેની મત ગણતરીમાંથી ૮ ઉમેદવાર પ્રમોદ રાણા, વોર્ડ નંબર વોર્ડના ભાજપ ઉમેદવારો વિજેતા ૩માં ફિરદૌસ બાનું(કોંગ્રેસ), વોર્ડ

Half Year

(165

(165)

(167)

(169)

1134

1620

(1.49) (1.49)

For Supertex Industries Limite R. K. Mishr

Chairman & Managing Director

rly Financial Results file

20

20

14

1134

1717

રશ્મિકાબેન હળપતિ, વોર્ડ નંબર દમાં ચંડોક જશવિંદર કૌર, વોર્ડ વિજેતા નંબર ૭માં અસ્પી દમણિયા, વોર્ડ

ન્યા હતા.દમણ ભાજપે કુલ ૧૧ નંબર ૪માં અપક્ષ અશરાર અલીરજા તો, વોર્ડ નંબર ૧૩માં ભાજપના માતર, વોર્ડ નંબર ૫માં ભાજપના વિનય પટેલ અને વોર્ડ નંબર ૧૪માં સોહીનાબેન ૨જનીકાંત પટેલ બન્યા નગરપાલિકાની ૧૫ સીટમાંથી ૩ નંબર ૮માં ચંદ્રગીરી ઈશ્વર, વોર્ડ સીટ પર ભાજપ બિનહરીફ જાહેર નંબર ૯માં આશિષ ટંડેલ, વોર્ડ નંબર થયા બાદ ૧૨ વોર્ડ માટેની મત ૧૦માં મુકેશ પટેલ વિજેતા બન્યા ગણતરીમાંથી ૮ વોર્ડના ભાજપ હતાં. એ સાથે વોર્ડ નંબર પથી ૧૦ ઉમેદવારો વિજેતા બન્યા હતા.દમણ વોર્ડમાં ભાજપે કબ્જો મેળવ્યો હતો. ભાજપે કુલ ૧૧ સીટ પર કબ્જો વોર્ડ નંબર ૧૧માં અપક્ષ ઉમેદવાર જમાવતા દમણ નગરપાલિકા નયનાબેન ટંડેલ વિજેતા બન્યા હતાં. ભાજપના ફાળે ગઈ છે.

સુરત વરીયાવી બજારમાંથી બીલ વગરનો બ્રાન્ડેડ કંપનીના શૂઝનો જથ્થો ઝડપાયો

વરીયાળી બજાર કોળીવાડમાં આવેલ એક દુકાનમાં પીસીબીએ રેડ પાડી જેથ્થો કબજે કરી દુકાનદારની મંહમંદમીયાં ધરપકડ કરી હતી. પીસીબીના (ઉ.વ.૨૯.૨હે, માટે કાર્યવાહી કરવા માટે સુચના હતા તે વખતે કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ અને હેડ કોન્સ્ટેબલ મળી હતી કે, ઝાહીદ મોહમંદ મીયાં વાહેદકલામ બીલ વગરના નાઈકી, અડીદાસ જેવા ઈન્ટરનેશનલ બ્રાંડના શુઝનું વેચાણ કરે છે અને હાલમાં કરી હતી.

દિવાળીના તહેવાર અનુસંધાને શહેરના મુગલીસરા મેઈન રોડ પોતાની લાલગેટ વરીયાળી બજાર કોળીવાડ ખાતે મીરઝા સ્વામી હોલની સામે આવેલ ઓફિસમાં હતી. જેમાં બીલ વગરના નાઈકી, સ્ટોક કરી રાખ્યો છે. બાતમીના એડીદાસ અને ફિલા કંપનીના આધારે સ્ટાફના માણસો સાથે રેડ શૂઝનો કુલ રૂપિયા ૪.૧૦ લાખનો પાડી હતી. જેમાં ઝાહીદ વાહેદકલામ हेनाविदार જણાવ્યા મુજબ પોલીસ કમિશનર સોસાયટી અડાંજણ પાટીયા) અજયકુમાર તોમર દ્વારા દિવાળી ઓફિસમાં કાર્ટુન બોક્ષ નંગ-દમાંથી તહેવાર અનસંધાને શહેરમાં ચાલતા નાઈકી એડીદાસ અને કિલા ગેરકાયદેસર પ્રવૃતીઓને ડામવા કંપનીના શુઝની જાડી નં-૪૧૦ અને અનિચ્છનીય બનાવ ન બને તે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા ૪.૧૦ લાખ આપી હતી જે અંતર્ગત પીઆઈ થાય છે. આ ઉપરાંત પુઠાના બોક્ષ, ઓસ.જે.ભાટિયાના માર્ગદર્શન અને પ્લાસ્ટિકના થેલીઓ પણ મળી હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં આવી હતી. પીસીબીએ ઝાહીદ કલામને મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા કોઈ બીલ ચલણો કે અન્ય વિપુલભાઈ મંગુભાઈને એવી બાતમી કોઈ પુરાવા તેની પાસે નહી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ કુલ રૂપિયા ૪,૧૦.૩૦૦નો મુદ્દામાલ કબજે કરી ઝાહીદ કલામની ધરપકડ

દિવાળીનાં તહેવારોમાં ડોક્ટર ઓન કોલની સેવા તા. ૧૪ નવેમ્બર થી તા. ૧૯ નવેમ્બટર સુધી સેવા ઉપલબ્ધ



દિવાળીનાં અમદાવાદ, તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસો સિએશન (એએફપીએ)દ્વારા સતત ૧૦માં વર્ષે આશિર્વાદરૂપ પૂરવાર થયેલી આ ઈએમઆરઆઈ ૧૦૮ અને હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન આ ઉપરાંત દિવાળીનાં તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટસ એપ ગ્રુપ

નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે, 'દિવાળીનાં તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને દર્દીઓ માટે તા. ૧૪ નવેમ્બયર થી લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતુ તા. ૧૯ નવેમ્બવર ૨૦૨૦ હોય છે. દર્દીઓને અગવડો ના પડે દરમિયાન ડોક્ટર ઓન કોલની સેવા અને સમાજને મદદરૂપ થવાય તેવી રજૂ કરવામાં આવી છે. દર્દીઓ માટે ભાવનાથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને સેવામાં બંને એસોસિએશન દ્વારા અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ડોક્ટર ઓન કોલ સાધવામાં આવ્યું છે. એએમએ દ્વારા દિવાળી સેવાનું આયોજન કરવામાં આવે છે.' ડો. કિરીટ ગઢવીએ વધુમાં જણાવ્યુંય હતું કે, ''છેલ્લો છ માસથી બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરોની આપર્શે સૌ કોરોના રોગચાળામાંથી યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં પસાર થઈ રહ્યા છીએ. (૨૨-૧)



સ્થળ : વડોદરા

વન ગ્લોબલ સર્વિસ પ્રોવાઇડર લિ. (જે ઓવરસીસ સિન્થેટિક્સ લિમિટેડ નામે ઓળખાય છે) CIN-L74110GJ1992PLC017316 બ્લોક નં. ૩૫૫, મંજુસર કુમ્પાડ રોડ, ગામ- મંજુસર, તાલુકો- સાવલી,

વડોદરા, વડોદરા, ગુજરાત- ૩૯૧ ૭૭૫, ભારત

નોટિસ કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ એફેર મંત્રાલય(એમસીએ) દ્વારા જારી કરાયેલ પરિપત્ર ારીખ પ મે, ૨૦૨૦ સાથે પરિપત્ર તારીખ ૮, એપ્રિલ, ૨૦૨૦ ને અનુસરતા એક જસ્થળે સભ્યોની શારીશિક શુજરી વગર વીડિઓ કોન્કેંસ અથવા અન્ય ઓડિયો -વિઝૂયુઅલ એટલે (ઓએવીએમ) એજીએમ યોજવાની ૧૨વાનગી આપી છે. આ પરિપત્રો અને કંપની કાયદા ૨૦૧૩ની સંબંધિત જોગવાઈઓ અને સેબી (લીસ્ટીંગ મોબ્લીગેશન અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેંટ) નિયમનો, ૨૦૧૫ના અનુપાલન હેઠળ કંપની વીસી/ઓએવીએમ દ્વારા યોજવામાં આવશે

િડપોઝીટરીઓ પાસે જે સભ્યોના ઈ-મેઇલ આઈડી રજીસ્ટર્ડ છે તેમને કક્ત ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવી રહ્યાં છે, કંપનીએ તમામ સભ્યો માટે રિમોટ ઇ-વોટીંગ અને ઈ વોટિંગની સવલતની ઉક્ત પ્રકિયા દ્વારા શિદ્ર

સદરહું પરિપત્રો અંતર્ગત એજીએમ નોટિસ તેમજ વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપની અથવ

૮૦ના વાર્ષિક અહેવાલ અને ઇ- વોટીંગ માટે લોગીન્ડ વિગતો મેળવવા માટે ઈ-મેઇલ એડ્રેસ રજીસ્ટર કરવા માટે નીચેની સુચનાઓ અનુસરવા વિનંતી છે.

ફીઝિકલ	હોલ્ડીંગ	કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાંસકર એજેન્ટ, એમસીએસ શેર ટ્રાંસકર એજેંટ લિમિટેડ એટ્ટ mosstaahmd@gmail.com અથવા moslidbaroda@ gmail.com પર સહી સાથે વિનંતી પત્રમાં વિગતો જેવીકે કોલિયો નં., શેર હોલ્ડરના નામના શેર સર્ટિફિકેટ (સામે અને પાછળ)ની હેન્ડ કોપી, પાન (પાન કાર્ડની સેલ્ક એટેસ્ટેડ હેન્ડ કોપી), આધાર આધાર કાર્ડની સેલ્ક એટેસ્ટેડ હેન્ડ કોપી) સાથે ઈમેલ એટ્રેસ સ્કન્ડ કરાવા વિનંતી કરી શકો છો. ઈમેઇલ લાઇનનો વિષય - વન ઓબલ સર્વિસ પ્રોવાઇડર લિમિટેડ ના ઇમેઇલ આઇડી ફોલિયો નં.(ફોલિયો નં.જુલાવો) રજીસ્ટર કરવા માટે વિનંતી કરી શકો છો.	
02 20	v.	ໄລຂາງວ່າ ໄດ້ປຸກເຄັດຄຸ້ນເປັນຕໍ່ ຄູ່ໄດ້ຕາກ ຄູ່ໄດ້ຕາກ ໄດ້ເປັນຕາການ ຄວາມ ຄວາມ ໄດ້ຕາກ ເຂົ້າການ ຄວາມ ຄວາມ ໄດ້ຕາກ ໄດ້ຕ	

જીએમ નોટિસ તેમજ વાર્ષિક અહેવાલ ૨૦૧૯-૨૦ કંપનીની વેબ સાઇટ http://onegsp.smartwareinternational.ac ને બીએસઈ લિમિટેડ www.bseindia.com પર ઉપલબ્ધ રહેશે સભ્યોને વીસી/ઓએવીએમ દ્વારા સભ્યામાં હાજ હનારસભ્યો ને કંપની કાયદા ૨૦૧ ૩ની કલમ ૧૦૩ મુજબ ક્રોટમની ગણતરી કરવા માટે ધ્યાન માં લેવામાં આવશે.

Printed & Published by Mayur C. Bhatt on behalf of Kalyar Pub. Pvt. Ltd Printed at- Mahadev Offset, H-47 Ravi Estate Rustam Mill Compound, Dudheshwar, Ahmedbada-4 Published from 201-2, Nandan Com. Opp. Mithakhali Rly Crossing, Mithakhali, Ahd-6 Edi.: Mayur Bhatt ડિપી સાથે અપડેટ કરાવી લેવું .

REAL STRIPS LIMITED

Registered Office: Survey No.245-246, Village Sari, Ahmedabad-Bavla Highway, Taluka Sanand,
Dist.: Ahmedabad - 382220, Gujarat.
CIN.: L27100G31990PLC014383
Telephone: +91 92280 02011, +91 92280 02012
Email: ramcharan@realstrips.com Website: www.realstrips.com
Com. No. Bombay Stock Exchange :- 513558

Statement of Unaudited Financial Results for the Quarter and Half Year Ended 30th September 2020

(Rs In Lacs except as stated)						
	C	Quarter Ended		Half Yea	Year Ended	
PARTICULARS	30.09.2020	30.06.2020	30.09.2019	30.09.2020	30.09.2019	31.03.2020
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total Income from operations	3,226.53	1,227.67	2,615.97	4,454.20	5,308.48	10,248.67
Net Profit / (Loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	362.03	(279.56)	293.37	82.47	608.47	578.74
Net Profit / (Loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	362.03	(279.56)	293.37	82.47	608.47	578.74
Net Profit / (Loss) for the period (after tax, exceptional and / or extraordinary items)	362.03	(279.56)	293.37	82.47	608.47	465.15
Total Comprehensive Income for the period (comprising profit for the period after tax and other comprehensive income after tax)	-	=	1	=	-	(5.75)
Equity Share Capital (Face value of Rs.10/- each)	597.50	597.50	597.50	597.50	597.50	597.50
Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	=	·	-	-	(1,681.92)
Earnings Per Share (For Continuing and Discontinued operations) (Amount in Rs.)						
- Basic & Diluted (Not annualised)	6.05	(4.67)	4.91	1.38	10.18	7.78
Notes						

Place: Sari-Village Date : 12th November, 2020

The above unaudited financial results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on November 12, 2020. The aforesaid unaudited financial results have been subjected to limited review by the auditor of the

Company.

With the easing of lockdown in various states of India and the increasing economic activities in phased manner, the Company has continued its assessment of likely adverse impact on economic environment in general and financial risks on account of COVID-19. The Company has considered the possible effects that may result from the pandemic relating to COVID-19 on the carrying amounts of property, plant and equipment extrements, invest the assumptions relating to the possible developing analysis on the assumptions used and based on current extrements invest the assumptions relating to the possible fitting uncertainties in the plantal expositions including conditions including conditions and the possible fitting uncertainties in the plantal exposition in India. current estimates the assumptions relating to the possible future uncertainties in the global economic conditions including conditions in India current estimates the assumptions relating to the possible ruture uncertainties in the global economic contitions including conditions in India because of this pandemic, the Company, as at the date of approval of these financial results has used internal and external sources on the expected future performance of the Company. Based on current estimates expects the carrying amount of this assets are fully recoverable. The Company continues to regularly review and moderate their significant estimates, including regular discussions with its key customers and vendors. The Company believes that impact of COVID-19 on the Company's financial results is not material.

During the period, the part of the land of the company have been acquired by the Government and of which consideration of Rs 162.53 lacs has been received and gain thereon of Rs 162.38 lacs has been considered as "Other Income".

Figures of the previous periods have been regrouped and reclassified to confirm to the classification of the current period, wherever necessary.

For Real Strips Limited, Prakashraj S. Jain Joint Managing Director DIN - 00435076

MAS FINANCIAL SERVICES LTD.

Regd. Office: 6,Ground Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009.

Phone No.: +91 79 41106500, Fax No.: +91 79 41106597, E-mail: riddhi_bhayani@mas.co.in, Website: www.mas.co.in

CIN: L65910GJ1995PLC026064

Extract of standalone and consolidated unaudited financial results for the quarter and half year ended 30 September 2020

			Standalone			Consolidated	(₹ in Lal
Sr. No.	Particulars	Quarter ended 30 September 2020 (Unaudited)	Half year ended 30 September, 2020 (Unaudited)	Quarter ended 30 September, 2019 (Unaudited)	Quarter ended30 September 2020 (Unaudited)	Half year ended30 September, 2020(Unaudited)	Quarter ended 30 September 2019 (Unaudited)
1	Total income from operations	15,262.17	31,261.14	16,737.41	16,189.91	33,063.90	17,705.74
2	Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	4,563.10	9,455.15	4,999.81	4,712.13	9,744.15	5,140.40
3	Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	4,563.10	9,455.15	4,999.81	4,712.13	9,744.15	5,140.40
	Net profit / (loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	3,420.40	7,079.63	4,019.82	3,532.77	7,292.40	4,127.38
5	Total comprehensive income for the period [comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	2,787.93	6,959.00	4,311.21	2,914.60	7,164.48	4,417.58
6	Paid up equity share capital	5,466.20	5,466.20	5,466.20	5,466.20	5,466.20	5,466.20
7(i)	Earning per share(of ₹ 10/- each) (for continuing and discontinued operations) - ((including exceptional item) (not annualised for quarter))						
	1. Basic (₹)	6.26	12.95	7.35	6.38	13.18	7.47
	2. Diluted (₹)	6.26	12.95	7.35	6.38	13.18	7.47
7(ii)	Earning per share(of ₹ 10/- each) (for continuing and discontinued operations) - ((excluding exceptional item) (not annualised for quarter))						
	1. Basic (₹)	6.26	12.95	7.35	6.38	13.18	7.47
	2. Diluted (₹)	6.26	12.95	7.35	6.38	13.18	7.47

The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and half year ended 30 September 2020 which have been reviewed by the Audit Committee in their Meeting held on 10 November 2020 and the same was approved by the Board of Directors in their meeting held on 11 November 2020, subjected to a limited review by the Statutory Auditors and filed with the Stock Exchanges under Regulation 33 and Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the websites of the Stock Exchanges at www.bseindia.com, www.nseindia.com, and on the website of the Company at

results are available on the websites of the Stock Exclusings of the Company have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Indian Accounting Standard (referred to as 'Ind AS') - 34, Interim Financial Reporting prescribed under Section 133 of the Companies Act, 2013 (the 'Act') read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and in compliance with Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the 'SEBI Listing Regulations'). Any application guidance/ clarifications/ directions issued by Reserve Bank of India ('RBI') or other regulators are implemented as and when they are issued/ applicable.

For and on behalf of the Board of Directors of MAS Financial Services Ltd.

MAS Financial Services Ltd

Kamlesh C. Gandh (Chairman & Managing Director) (DIN - 00044852)

Place: Ahmedabad Date: 11 November 2020

> 🙏 zota healthcare Itd.
> ZOTA HEALTH CARE LIMITED

Registered office: Zota House, 2/896, Hira Modi Street, Sagr Email:info@zotahealthcare.com Website:www.zotahealthca ura, Surat-395002, Gujarat

	EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2020									
-			STANDALONE			(Rs. in Lakhs	s, except per share data)			
Sr. No.	Particulars	Quarter ended September 30, 2020 (unaudited)	Half Year Ended September 30, 2020 (unaudited)	Quarter ended September 30, 2019 (unaudited)	Quarter ended September 30, 2020 (unaudited)	Half Year Ended September 30, 2020 (unaudited)	Quarter ended September 30, 2019 (unaudited)			
1	Total Income from operations	2816.64	4571.60	2528.75	2816.64	4571.60	2528.75			
2	Net Profit for the period (before tax, exceptional and /or extraordinary items)	28.25	91.60	146.40	28.22	91.77	146.36			
3	Net Profit for the period before tax (after exceptional and /or extraordinary items)	131.13	194.48	146.40	131.10	194.65	146.36			
4	Net Profit for the period after tax (after exceptional and /or extraordinary items)	101.74	152.58	109.11	101.71	152.75	109.07			
5	Total Comprehensive income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax)]	112.72	160.96	112.54	112.70	161.14	112.41			
6	Paid-up Equity Share Capital (face value of Rs.10/- each)	2456.03	2456.03	2456.03	2456.03	2456.03	2456.03			
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year*									
8	Earnings Per Share (face value of Rs. 10/- each) (for continuing and discontinued operations) 1. Basic: 2. Diluted:	0.41 0.41	0.62 0.62	0.44 0.44	0.41 0.41	0.62 0.62	0.44 0.44			

ved for the year ended March 31, 2020 was standalone Rs. 4429.06 lakhs and consolidated Rs. 4426.87 lakhs

lotes

The above is an extract of the detailed format of Quarterly and Half yearly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Annual Financial Results are available on the websites of the National Stock Exchange of India at www.nseindia.com and on the website of the Company at the www.zotahealthcare.com.

The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors

at its meeting held on November 11,, 2020.

The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.

For and on behalf of Board of Directors

Moyesh 7of (Manac naging Director DIN: 07625219

ડીન: ૦૧૫૬૩૬૬૧